


RAN-2401001202010006
B.A. (Sem. - II) Examination November - 2025
Psychology (Major) (Paper - III) Domains of Modern General Psychology
Time: 2 Hours]
[Total Marks: 50
સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book
- (2) જમણી બાજુનાં અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.
Figure to the right indicates full marks of the question.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર.1. નીચેના પ્રશ્નોમાં દર્શાવ્યા મુજબ જવાબ આપો: (ગમે તે પાંચ)
10
Answer the following question as directed. (Any five)

1. શિક્ષણ પ્રક્રિયાના ચાર સિદ્ધાંતો જણાવો.
State the four principles of the learning process.
2. પુનરાવર્તન અને પુનરાવર્તનનો અર્થ જણાવો.
State the meaning of recall and repetition
3. કોઈપણ ચાર વૈયક્તિક આંતરિક ભિન્નતાઓ જણાવો.
State any four personal internal differences.
4. TAT કસોટીનું આખું નામ જણાવો.
State the full name of the TAT test.
5. સમસ્યા ઉકેલના ચાર પગથિયાં જણાવો.
State the four steps of problem solving.
6. કેશમેરે જણાવેલા વ્યક્તિત્વના ચાર પ્રકાર જણાવો
Name the four personality types mentioned by Kreschmer.
7. પઠન અને મુખપાઠનો અર્થ જણાવો.
State the meaning of reading and recitation.

પ્ર.2. શીખવાની વસ્તુને લગતા અને શીખવાની પદ્ધતિને લગતા પરિબલોની ચર્ચા કરો.
14

Discuss the factors related to learning material and the method of learning.

અથવા / OR
પ્ર.2. વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબલોની ચર્ચા કરો.

Discuss the affecting factors of personality development.

પ્ર.3. A. વિસ્મરણના સિદ્ધાંતો વર્ણવો.
07

Describe the principles of forgetting.

પ્ર.3. B. સર્જનાત્મક વિચારણા એટલે શું? તેના તબક્કાઓ જણાવો.
07

What is creative thinking? Mention its stages.

- પ્ર.3. A. વ્યક્તિગત ભિન્નતાનું સ્વરૂપ વર્ણવો. 07
Describe the nature of individual differences.
- પ્ર.3. B. વિચાર ક્રિયાના પ્રકારોની સમજૂતી આપો. 07
Explain the types of thought processes.
- પ્ર.4. વર્ણનાત્મક નોંધ લખો. (ગમે તે બે) 12
Write a descriptive note: (any two)
1. શિક્ષણ સંક્રમણ
Transfer of training
 2. સ્મૃતિના પ્રકારો
Types of memory
 3. વિચાર ક્રિયામાં ક્ષતિઓ
Impairments in thinking
 4. વ્યક્તિત્વ સુધારી શકાય ખરું? કેવી રીતે?
Can personality be improved? How?
-